

અરબી-ગુજરાતી

કુરઆને મજીદ

પારા-૨

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાયોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● **LIKE US ON FACEBOOK** ●

HOME | કુરઆને મજીદ (પારા-૨) -1 | **VISIT US**

નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે www.hajinaji.com પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

hajinajitrust@gmail.com

અનુક્રમણિકા

નં.	સૂરાનું નામ	પેજ
૨	સૂર-એ-બકરહ (આયત ૧૪૨ થી ૨૫૨)	૪

સુરએ બકરહ / سورة البقرة

سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَهُمْ عَن قِبَلَتِهِمُ الَّذِي
كَانُوا عَلَيْهَا ط قُلْ لِلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ط يَهْدِي مَنْ يَشَاءُ
إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ ﴿١٣٢﴾

(૧૪૨) (તે સમય) પાસે છે કે લોકો માંહેના મૂર્ખાઓ કહેશે કે જે કિબ્લા (બયતુલ મુકદ્દસ) તરફ એ (મુસ્લિમ) લોકો નમાઝ પઢ્યા કરતા હતા (હવે) તેમને (તેમ કરતાં) કઈ વસ્તુએ ફેરવી નાખ્યા ? (અય રસૂલ!) કહે કે પૂર્વ અને પશ્ચિમ (બંને) અલ્લાહના છે; તે જેને યાહે છે (તેને) સન્માર્ગની હિદાયત કરે છે.

وَكَذَلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ
 وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي
 كُنْتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَنْ يَتَّبِعُ الرَّسُولَ مِمَّنْ يَنْقَلِبُ عَلَى
 عَقْبَيْهِ ۗ وَإِنْ كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا
 كَانَ اللَّهُ لِيُضَيِّعَ إِيمَانَكُمْ ۗ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ
 رَّحِيمٌ ﴿١٣٣﴾

(૧૪૩) અને એવી રીતે અમોએ તમને વચલું
 (ન્યાયી) મંડળ બનાવ્યું છે કે જેથી તમે લોકો
 ઉપર સાક્ષી રહો અને રસૂલ તમારા ઉપર સાક્ષી
 રહે, અને જે કિબ્લા તરફ તું નમાઝ પઢ્યા કરતો

હતો તે અમોએ એ માટે નક્કી કર્યો હતો કે (જ્યારે કિબ્લો બદલવામાં આવે) ત્યારે રસૂલનું કોણ અનુકરણ કરે છે અને કોણ પાછલા પગે ફરી જાય છે તેમને જાણી લઇએ; અને એ (કિબ્લાનું બદલવું) સઘળાઓ માટે ભારે થઇ પડ્યું હતું, સિવાય તેમના કે જેમને અલ્લાહે સન્માર્ગની સુબુધ્ધિ આપી છે; અને અલ્લાહ એવો નથી કે તમારા ઇમાનને બરબાદ કરે; બેશક અલ્લાહ સર્વ લોકો પર મોટો માયાળુ (અને) દયા કરનાર છે.

قَدْ نَرَى تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۗ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۗ وَحَيْثُ مَا

كُنْتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ
لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّهِمْ ط وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا
يَعْمَلُونَ ﴿١٣٣﴾

(૧૪૪) તારું આકાશ તરફ મોંઢું ફેરવવું અમે
ખચીતજ નિહાળીએ છીએ, જેથી જરૂર અમે તારું
મુખ એવા એક કિબ્લા તરફ ફેરવી દઇશું કે જેથી
તું ખુશ થશે, ત્યારે હવે તું તારું મુખ મસ્જિદુલ
હરામ (કાઅબા) તરફ ફેરવ; અને જ્યાં પણ તમે
હો તેનીજ તરફ તમારું મુખ ફેરવો; અને નિ:સંશય
જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ સારી પેઠે
જાણે છે કે તે (કિબ્લાનું બદલવું) તેમના

પરવરદિગાર તરફથી છે અને તે સત્ય છે; અને જે કાર્યો તેઓ કરી રહ્યા છે તેનાથી અલ્લાહ અજાણ નથી.

وَلَيْنٌ آتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبَلَتِكَ ۖ وَمَا أَنْتَ بِتَابِعٍ قِبَلَتِهِمْ ۗ وَمَا بَعْضُهُمْ بِتَابِعٍ قِبَلَةَ بَعْضٍ ۗ وَلَيْنِ اتَّبَعْتَ أَهْوَاءَهُمْ مِّنْ بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ ۗ إِنَّكَ إِذًا لِّمِنَ الظَّالِمِينَ ﴿١٣٥﴾

(૧૪૫) અને જેમને કિતાબ આપવામાં આવી છે તેમની સામે અગર તું (દરેકે) દરેક નિશાની રજૂ કરે તો પણ તેઓ તારા કિબ્લાને અનુસરશે નહિ, તેમજ તું પણ તેમના કિબ્લાને અનુસરનાર નથી,

અને તેઓ માંહેનો કોઈ (પક્ષ) બીજા કોઈ (પક્ષ) ના કિબ્લાને અનુસરનાર નથી; અને તને જે જ્ઞાન મળી ચૂક્યું છે તે પછી પણ જો તું તેમની ઈચ્છાઓને અનુસરશે તો એ સ્થિતિમાં તું પણ ખરેખર ઝુલમગારો માંહેનો ઠરશે.

الَّذِينَ اتَّيْنَهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ط
وَإِنَّ فَرِيقًا مِنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ ﴿٣٣﴾

(૧૪૬) જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તે (રસૂલ) ને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના ફરઝંદોને ઓળખે છે; અને બેશક તેઓ માંહેનો એક ભાગ એવો છે કે જે જાણી જોઈને સત્યને સંતાડે છે.

أَلْحَقُّ مِنْ رَبِّكَ فَلَا تَكُونَنَّ مِنَ الْمُبْتَرِينَ ﴿١٤٧﴾

(૧૪૭) આ સત્ય તારા પરવરદિગાર તરફથી જ છે માટે તું કદી પણ શંકા કરનારાઓ માંહેનો થઈશ નહિ.

وَلِكُلِّ وِجْهَةٍ هُوَ مَوْلِيٌّهَا فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا

يَأْتِ بِكُمْ اللَّهُ جَمِيعًا ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿١٤٨﴾

(૧૪૮) અને દરેક ટોળા માટે એક દિશા (ઠરાવેલી) છે કે જે દિશા તરફ તેઓ મુખ કરે, માટે તમે સારા કાર્યોમાં એક બીજા સાથે હરીફાઈ કરો; જ્યાં પણ તમે હશો (ત્યાંથી) અલ્લાહ તમો સર્વને

(કયામતના દિવસે) ભેગા કરી લાવશે; નિસંશય અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવે છે.

وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ط

وَإِنَّهُ لَلْحَقُّ مِنْ رَبِّكَ ط وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ﴿١٣٩﴾

(૧૪૯) અને ગમે તે જગ્યાએથી તું બહાર નીકળે તો તારૂં મોઢું મસ્જિદુલ હરામ તરફ કરતો રહે, બેશક આ (આજ્ઞા) તારા પરવરદિગાર તરફથી છે અને તે સત્ય છે; અને અલ્લાહ તમારા કર્મોથી અજાણ નથી.

وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ط

وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ ۖ لِئَلَّا يَكُونَ

لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي ۚ وَلَا تَمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ ﴿١٥٠﴾

(૧૫૦) અને જ્યાંથી (પણ) તું નીકળે તારું મોઢું મસ્જિદુલ હરામ તરફ કર; અને તમે ગમે ત્યાં હો તમારું મોઢું તેની જ તરફ કરો. જેથી લોકોના આક્ષેપ તમારા પર ટકી શકે નહિ, સિવાય તેમના કે જેઓ તેમાંથી ઝુલમગાર છે, (તેઓ તો આ જાણ્યા છતાં આક્ષેપો કરશે જ) માટે (તમે) તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરતા રહો, આ એ માટે કે હું મારી નેઅમતો તમારા ઉપર

પૂરી કરી દઉં. અને એ માટે કે તમે સન્માર્ગ
મેળવો.

كَمَا أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنْكُمْ يَتْلُوا عَلَيْكُمْ آيَاتِنَا
وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ
تَكُونُوا تَعْلَمُونَ ﴿١٥١﴾

(૧૫૧) (કિબ્લાનું બદલવું એક એવી નેઅમત છે)
જેવી કે અમોએ તમારામાંથી એક રસૂલ તમારામાં
મોકલ્યો જે અમારી આયતો તમને વાંચી સંભળાવે
છે તથા તમને પવિત્ર કરે છે અને તમને કિતાબ
તથા હિકમત (ખરૂં ખોટું પારખવાનાં જ્ઞાન)નું

શિક્ષણ આપે છે અને જે તમે જાણતા ન હતા તે તમને શીખવાડે છે.

فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِي وَلَا تَكْفُرُونِ ﴿١٥٢﴾

(૧૫૨) માટે તમે મારી યાદ કરતા રહો કે હું પણ તમારી યાદ કરું, અને મારો શુક્રિયા અદા કરતા રહો, અને નાશુકા બનો નહિ.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ إِنَّ اللَّهَ مَعَ

الصَّابِرِينَ ﴿١٥٣﴾

(૧૫૩) અય ઈમાનલાવનારાઓ! ધીરજ અને નમાઝ વડે મારી મદદ માંગતા રહો, બેશક અલ્લાહ ધીરજ ધરનારાઓની સાથે જ છે.

وَلَا تَقُولُوا لِمَنْ يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ
 وَلَكِنْ لَا تَشْعُرُونَ ﴿١٥٣﴾

(૧૫૪) અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા
 જાય છે તેમને મરણ પામેલા કહો નહિ; બલકે તેઓ
 હયાત છે પરંતુ તેનું તમને ભાન નથી.

وَلَنَبَلُوَنَّكُمْ بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ
 وَالْأَنْفُسِ وَالشَّمْرِتِ ۚ وَبَشِيرِ الصَّابِرِينَ ﴿١٥٥﴾

(૧૫૫) અને અમે તમારી થોડાક ભયથી અને
 થોડીક ભૂખથી તથા માલ તથા પ્રાણ અને ફળો
 (ફરઝંદો) ના નુકસાનથી અજમાયશ (કસોટી)

કરીશું; અને (અથ રસૂલ!) સબર કરનારાઓને ખુશ
ખબર સંભળાવી દે:

الَّذِينَ إِذَا أَصَابَتْهُمْ مُصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ
رَاجِعُونَ ﴿١٥٦﴾

(૧૫૬) કે જેઓ સંકટ આવી પડતાં કહે છે કે બેશક
અમે અલ્લાહનાજ છીએ અને અમે તેનીજ હજુરમાં
પાછા ફરીને જનાર છીએ.

أُولَئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ وَأُولَئِكَ هُمُ
الْمُهْتَدُونَ ﴿١٥٤﴾

(૧૫૭) એ તેજ લોકો છે કે જેમના ઉપર તેમના પરવરદિગાર તરફથી આશીર્વાદ અને રહેમત હોય છે; અને તેઓજ સન્માર્ગને પામેલા છે.

إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَائِرِ اللَّهِ ۗ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوْ
اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَنْ يَطَّوَّفَ بِهِمَا ۗ وَمَنْ تَطَوَّعَ خَيْرًا
فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ ﴿١٥٨﴾

(૧૫૮) બેશક "સફા" તથા "મરવા" અલ્લાહની નિશાનીઓમાંથી છે, માટે જે કોઈ બયતુલ્લાહ (કાઅબા)ની હજ અથવા ઉમરા અદા કરે તેના માટે તે (સફા અને મરવાની) વચ્ચે તવાફુક

કરવામાં કાંઈ દોષ નથી; અને જે સ્વયં નેકી કરે છે તો બેશક અલ્લાહ કદર કરનાર અને જાણનાર છે.

إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا آتَيْنَاهُمْ مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِنْ بَعْدِ
مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۗ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ
اللَّعْنُونَ ﴿١٥٩﴾

(૧૫૯) અને નિસંશય જે લોકો અમારી ઉતારેલી ખુલ્લી નિશાનીઓ અને સન્માર્ગની વાતો (કે જે અમોએ) સર્વે માણસો (ના લાભ) માટે કિતાબ (કુરઆન તથા તૌરેત)માં સ્પષ્ટ કરીને વર્ણવી દીધા પછી (પણ) સંતાડે છે, તો એવા લોકો પર

અલ્લાહ ફિટકાર કરે છે, અને ફિટકાર કરનારાઓ
(પણ) તેમના ઉપર ફિટકાર કરે છે.

إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُّوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۗ

وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ ﴿١٣٠﴾

(૧૬૦) પરંતુ જેમણે પ્રશ્નાતાપ કર્યો અને સુધારણા
કરી અને (અમોએ જે સત્ય પ્રગટ કર્યું હતું તેને)
સ્પષ્ટ (કરીને) વર્ણવી દીધું તો એવા લોકોની
તૌબા હું કબૂલ કરી લઈશ, અને હું તૌબાનો મહાન
કબૂલ કરનાર (અને) દયા કરનાર છું.

إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارًا أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ

اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ ﴿١٣١﴾

(૧૬૧) બેશક જે લોકો (સમજ્યા છતાં) ઈમાન લાવ્યા નહિ અને બેઈમાનીની સ્થિતિમાંજ મરી ગયા તેમના ઉપર અલ્લાહનો, સઘળા ફરિશ્તાઓનો તેમજ ઘણા માણસોનો ફિટકાર છે.

خَلِيدِينَ فِيهَا ۗ لَا يُخَفَّفُ عَنْهُمْ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ ﴿٣٣﴾

(૧૬૨) જેમાં તેઓ હંમેશને માટે રહેશે, તેમનો અઝાબ હરગિજ હળવો કરવામાં આવશે નહિ, તેમ તેમને મોહલત (પણ) આપવામાં આવશે નહિ.

وَالْهُكْمُ لِلَّهِ وَالْأَحْكَامُ لِلَّهِ ۗ لَا إِلَهَ إِلَّا هُوَ الرَّحْمَنُ الرَّحِيمُ ﴿٣٤﴾

(૧૬૩) અને તમારો માઅબુદ એક જ માઅબુદ છે, તે રહમાન તથા રહીમના સિવાય અન્ય કોઈ માઅબુદ નથી.

إِنَّ فِي خَلْقِ السَّمَوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ
 وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنْفَعُ النَّاسَ وَمَا أَنْزَلَ اللَّهُ
 مِنَ السَّمَاءِ مِنْ مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا
 مِنْ كُلِّ دَابَّةٍ ۗ وَتَصْرِيفِ الرِّيحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ
 السَّمَاءِ وَالْأَرْضِ لآيَاتٍ لِقَوْمٍ يَعْقِلُونَ ﴿١٦٣﴾

(૧૬૪) નિસંશય આકાશો તથા પૃથ્વીના સર્જનમાં
 તથા રાત અને દિવસના ક્રમમાં અને તે વહાણોમાં
 (કે) જે સમુદ્રમાં લોકોપયોગી (સામાન) ની સાથે
 તરતા ફરે છે, અને તે પાણીમાં કે જે અલ્લાહ
 આકાશમાંથી ઉતારે છે, પછી જે વડે પૃથ્વીને તેના
 મરણ પછી પુનઃ સજીવન કરીને દરેક પ્રકારના

પ્રાણીમાત્રને તેમાં (મોટી સંખ્યામાં) ફેલાવી દે છે, અને વાયુઓના ફેરફારમાં તથા તે વાદળાંઓમાં કે જે આકાશમાં અને પૃથ્વી વચ્ચે (અલ્લાહની) આજ્ઞાને આધીન રહી છવાઈ રહે છે, (એ સર્વેમાં) સમજ ધરાવનાર લોકોમાટે (ઘણી) નિશાનીઓ મૌજૂદ છે.

وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرُونَ الْعَذَابَ ۙ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا ۙ وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ ۝

(૧૬૫) અને લોકોમાંથી એવા પણ છે કે જેઓ અલ્લાહને છોડી બીજાઓને પણ અલ્લાહના જેવા જ ગણે છે, જેમના માટે પણ તેઓ (એક જ) અલ્લાહના જેવી યાહના ધરાવે છે; પણ જેઓ ઈમાન લાવ્યા છે તેમને (સૌ કરતાં) વધુ મોહબ્બત અલ્લાહ પ્રત્યેની હોય છે અને જો આ ઝુલ્મગારોને તે અત્યારે જ સૂઝી આવતે તો કેવું સારૂ થતે કે જે (તેઓને) અઝાબ જોયા પછી સૂઝી આવશે, કે સંપૂર્ણ શક્તિ અલ્લાહની જ છે, અને આ પણ કે અલ્લાહ સખત અઝાબ આપનાર છે.

إِذْ تَبَرَّأَ الَّذِينَ اتَّبَعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوْا الْعَذَابَ
وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ ﴿١٦٦﴾

(૧૬૬) જ્યારે (કયામતના દિવસે) તેઓ કે જેમની તાબેદારી કરવામાં આવી હતી, તેઓ તેમની તાબેદારી કરનારાઓ પ્રત્યે ધૃણા (બેઝારી) દાખવશે, અને અઝાબ તેમની નઝરે પડશે અને તેમના છૂટકારાના સર્વે સાધનો તૂટી જશે.

وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ط كَذَلِكَ يُرِيهِمُ اللَّهُ أَعْمَالَهُمْ حَسْرَتٍ عَلَيْهِمْ ط
 وَمَا هُمْ بِخَارِجِينَ مِنَ النَّارِ ﴿١٦٤﴾

(૧૬૭) અને (ત્યારે) તાબેદારી કરનારાઓ કહેશે કે કદાચને અમને (દુનિયામાં) પાછુ જવાનું મળે તો અમે પણ તેમના પ્રત્યે એવી જ બેઝારી યાદીએ

જેવી કે અત્યારે તેમણે અમારી પ્રત્યે યાહી છે, આ પ્રમાણે અલ્લાહ તેમના કર્મો તેમને ખેદ ઉપજાવનારા બનાવીને દેખાડશે, અને તેઓ જહન્નમમાંથી નીકળવા પામશે નહિ.

يَأْتِيهَا النَّاسُ كُلُّوا مِمَّا فِي الْأَرْضِ حَلَلًا طَيِّبًا ۖ وَلَا تَتَّبِعُوا
خُطُوَاتِ الشَّيْطَانِ ۗ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ ﴿١٣٨﴾

(૧૬૮) અય લોકો! જમીનમાંથી (નીકળતી) હલાલ તથા પાક વસ્તુઓ ખાઓ, અને શૈતાનના પગલે ચાલો નહિ, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.

إِمَّا يَأْمُرُكُمْ بِالسُّوْءِ وَالْفَحْشَاءِ وَأَنْ تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا
تَعْلَمُونَ ﴿١٣٩﴾

(૧૬૯) (એ) સિવાય (બીજું) કાંઈજ નથી. (કે) તે તમને દુષ્ટ કાર્યો કરવાની તથા નિર્લજ પણે (વર્તવા)ની આજ્ઞા કરે છે જેની તમને સમજ નથી.

وَإِذَا قِيلَ لَهُمْ اتَّبِعُوا مَا أَنْزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا أَوْلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ ﴿٤٠﴾

(૧૭૦) અને જ્યારે તમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તેને અનુસરો ત્યારે તેઓ કહે છે કે અમે તો તેનેજ અનુસરીશું કે જેને અમારા બાપદાદાઓને અનુસરતા અમોએ જોયા છે; જો કે તેમના બાપદાદા કોઈ વસ્તુની સમજ

ધરાવતા ન હતા (તેમજ) હિદાયત (પણ) પામેલા
ન હતા તે છતાંય શું (તેઓ તેમને અનુસરશે?)

وَمَثَلِ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الذِّبْيِ يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا
دُعَاءَ وَنِدَاءَ ط صُمُّ بَكُمْ عُمَىٰ فَهُمْ لَا يَعْقِلُونَ ﴿١٤١﴾

(૧૭૧) અને ઈમાન નહિ લાવનારાઓનો દાખલો
તે (શખ્સ)ના દાખલા જેવો છે કે જે (માત્ર) બૂમ
બરાડા સિવાય કાંઈજ સાંભળતા નથી; (કેમકે
તેઓ) બહેરા મૂંગા (અને) આંધળા છે માટે તેઓ
કાંઈજ સમજતા નથી.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا
لِلَّهِ إِنَّ كُنْتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ﴿١٤٢﴾

(૧૭૨) અથ ઈમાન લાવનારાઓ! જે પાક વસ્તુઓની અમોએ તમને રોજી આપી છે તેમાંથી ખાઓ પીઓ અને અલ્લાહનો આભાર માનો અગર તમે તેનાજ (નિસ્વાર્થ) બંદા હો!

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالِدًا وَنَحْمَ الْخِنْزِيرِ وَمَا أُهْلَ بِهِ
لِغَيْرِ اللَّهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۗ إِنَّ

اللَّهُ غَفُورٌ رَّحِيمٌ ﴿١٤٣﴾

(૧૭૩) તેણે તમારા ઉપર મરી ગયેલાં જાનવર તથા લોહી તથા સુવ્વરનું માંસ અને અલ્લાહનું નામ (લીધા) વિના ઝબેહ (ઝબ્હ) કરેલું હરામ કર્યું છે, પછી જે કોઈ ભૂખમરાથી (લાચાર બની ગયો)

હોય પણ નાફરમાની કરતો ન હોય તેમ હદથી આગળ વધી જનાર ન હોય (અને આ વસ્તુઓ પૈકી કોઈનું સેવન કરે) તો તેના માટે કાંઈ ગુનાહ નથી; બેશક અલ્લાહ મહાન ક્ષમા કરનાર (અને) દયા કરનાર છે.

إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنْزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ
 ثَمَنًا قَلِيلًا ۖ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا
 يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ ۗ وَلَهُمْ عَذَابٌ
 أَلِيمٌ ﴿٤٣﴾

(૧૭૪) બેશક જે લોકો અલ્લાહે ઉતારેલી કિતાબમાંના કોઈ ભાગને સંતાડે છે અને

(દુનિયાના સ્વાર્થ માટે) તેના બદલામાં થોડી કિંમત મેળવે છે તેઓ બીજું કંઈ નહિ પણ પોતાના પેટમાં આગ ભરે છે અને અલ્લાહ કયામતના દિવસે તેમની સાથે વાત કરશે નહિ તથા તેમને પવિત્ર પણ કરશે નહિ, અને તેમના માટે દુઃખ દાયક અઝાબ છે.

أُولَئِكَ الَّذِينَ اشْتَرُوا الضَّلَالَةَ بِالْهُدَى وَالْعَذَابِ
 بِالْمَغْفِرَةِ ۖ فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ ﴿٤٥﴾

(૧૭૫) આ તે (લોકો) જ છે કે જેમણે (આલોકમાં) હિદાયતને બદલે ગુમરાહી અને (પરલોકમાં) ક્ષમાને બદલે અઝાબ વેચાતો લીધો છે, તો તેઓ

જહન્નમની આગનો સામનો કરવા (માટે) કેવા
ઘૈર્યવાન છે!

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الْكِتٰبَ بِالْحَقِّ ۗ وَاِنَّ الَّذِيْنَ اٰخْتَلَفُوْا فِي
الْكِتٰبِ لَفِيْ شِقَاقٍ بَعِيْدٍ ﴿٩٥﴾

(૧૭૬) આ એ માટે કે ખરેખર આ કિતાબ અલ્લાહે
સત્ય પૂર્વક ઉતારી છે; અને જે લોકોએ આ
કિતાબમાં મતભેદ કર્યો છે તેઓ નિસંશય હદ
ઉપરાંતની વિરુદ્ધતામાં પડ્યા છે.

لَيْسَ الْبِرَّ اَنْ تُوَلُّوْا وُجُوْهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ
وَلَكِنَّ الْبِرَّ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَالْمَلٰٓئِكَةِ وَالْكِتٰبِ
وَالنَّبِيِّنَّ ۗ وَاٰتَى الْمَالَ عَلَى حُبِّهٖ ذَوِي الْقُرْبٰى وَالْيَتٰمٰى

وَالْمَسْكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ ۗ
 وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ ۗ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا
 عَاهَدُوا ۗ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ
 أُولَئِكَ الَّذِينَ صَدَقُوا ۗ وَأُولَئِكَ هُمُ الْمُتَّقُونَ ﴿٩٩﴾

(૧૭૭) તમે તમારા મુખ પૂર્વ અથવા પશ્ચિમ તરફ
 કરો એમાં સદગુણ નથી બલકે સદગુણતો એ જ છે
 કે અલ્લાહ પર તથા કયામતના દિવસ પર તથા
 ફરિશ્તાઓ પર તથા (આકાશી) કિતાબો પર અને
 નબીઓ પર ઈમાન લાવવું, અને અલ્લાહની
 મોહબ્બતમાં (પોતાના) સગાં વહાલાંને તથા
 અનાથોને તથા મોહતાજોને તથા મુસાફરોને તથા

સવાલ કરનારાઓને અને ગરદનોને છોડાવવામાં (ગુલામોને આઝાદ કરાવવા માટે) માલની સહાય આપવી, તથા નમાઝ કાયમ કરવી તથા ઝકાત આપવી, અને જ્યારે તેઓ (કોઈ વાતનો) વાચદો કરે છે ત્યારે પોતાના વાચદાને પાળનાર હોય છે, અને તંગીમાં તથા મુસીબતમાં અને લડાઈની સખતાઈ વખતે ધીરજ ધરનારા હોય છે; આ એજ લોકો છે કે જેઓ (ધર્મને અનુસરી) સત્ય બોલ્યા છે; અને તેઓજ (અલ્લાહથી) ડરીને ચાલનારા છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلِ ط الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأَنْثَىٰ بِالْأَنْثَىٰ ط فَمَنْ عَفِيَ لَهُ مِنْ أَخِيهِ

شَيْءٌ فَاتَّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ
 تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ
 عَذَابٌ أَلِيمٌ ﴿٧٧﴾

(૧૭૮) અય ઈમાન લાવનારાઓ! જેઓ (વિના કારણે) કતલ કરવામાં આવ્યા હોય તેમના વિષે બદલો લેવાનું તમારા ઉપર વાજિબ કરવામાં આવ્યું છે; (એટલે કે જો) આઝાદ (માર્યો ગયો હોય તો) તેને બદલે આઝાદ તથા ગુલામના બદલે ગુલામ તથા સ્ત્રીને બદલે સ્ત્રી; પછી જે (ખૂની) ને તેના (મોઅમીન) ભાઈ તરફથી કાંઈ માફ કરવામાં આવે તો (માફ કરનારાએ) બદલો માંગવામાં

યોગ્ય રીતે વર્તવું અને તે (બદલો) તે (મરનારના વારસો) ને ઉપકારવશ થઈ આપવો. આ તમારા પરવરદિગાર તરફથી સુગમતા અને મહેરબાની છે; પછી તે બાદ (તે બંને પૈકી) કોઈ હદ બહાર જાય તો તેના માટે દુઃખદાયક અઝાબ છે.

وَلَكُمْ فِي الْقِصَاصِ حَيٰوةٌ يَاۗوۡلِيَ الْاَلۡبَابِ لَعَلَّكُمْ تَتَّقُوۡنَ ﴿٤٩﴾

(૧૭૯) અને અય બુદ્ધિશાળીઓ! બદલા (ને લગતી આજ્ઞા) માં તમારા માટે જીવન છે કે જેથી તમે ગુનાહ કરતાં અટકો!

كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدُكُمْ الْمَوْتُ إِنْ تَرَكَ خَيْرًا ۗ
الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۗ حَقًّا عَلَى
الْمُتَّقِينَ ﴿١٨٠﴾

(૧૮૦) (વળી) તમારા ઉપર આ પણ લખી દેવા
(વાજિબ કરવા) માં આવ્યું છે કે જ્યારે
તમારામાંથી કોઈનો મરણ (સમય) આવી પહોંચે
(અને) જો તે કાંઈ મિલકત મૂકી જાય તો પોતાના
મા બાપ તથા નિકટના સગાંઓના લાભમાં
શરીઅત (ધર્મ નિયમો) ને અનુસરી વસિયત કરે,
પરહેઝગારો પર (આ પણ) એક ફરજ છે.

فَمَنْ بَدَّلَهُ بَعْدَ مَا سَمِعَهُ فَأَيْمًا إِيْمَةٌ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۗ إِنَّ
اللَّهَ سَمِيعٌ عَلِيمٌ ﴿١٨١﴾

(૧૮૧) પછી જે કોઈ તે (વસિયત) સાંભળ્યા પછી તેને બદલી નાખે તો તેનો ગુનોહ તેમનાજ શિરે રહેશે કે જેઓ તેને બદલી નાખશે; બેશક અલ્લાહ મહાન સાંભળનાર (અને) જાણનાર છે.

فَمَنْ خَافَ مِنْ مَوْصٍ جَنَفًا أَوْ إِيمًا فَاصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ
عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ ﴿١٨٢﴾

(૧૮૨) પછી જે કોઈને વસિયત કરનાર તરફથી તેની વસિયતમાં કાયદા વિરુદ્ધ (હોવા) નો અથવા અન્યાય થવાનો ભય હોય અને (તેથી) જો તે

માંહો માંહે સલાહ (સુલેહ) કરાવી આપે તો તેના પર કાંઈ ગુનાહ નથી; બેશક અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى
الَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ﴿١٨٣﴾

(૧૮૩) અય ઈમાન લાવનારાઓ! તમારા ઉપર રોઝા રાખવાનું એવી જ રીતે વાજિબ કરવામાં આવ્યું છે કે જેવી રીતે તમારા પૂર્વજો ઉપર વાજિબ કરવામાં આવ્યું હતું, આ એ માટે કે તમે પરહેઝગાર બનો:

أَيَّامًا مَّعْدُودَاتٍ ۖ فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِيضًا أَوْ عَلَى سَفَرٍ فَعِدَّةٌ
 مِنْ أَيَّامٍ أُخَرَ ۗ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ
 مِسْكِينٍ ۖ فَمَنْ تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَهُ ۖ وَأَنْ تَصُومُوا خَيْرٌ
 لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ ﴿۱۸۴﴾

(૧૮૪) (તે રોઝા અમુક) ગણતરીના દિવસો (છે);
 પણ તમારામાંથી જે કોઈ બીમાર હોય અથવા
 મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (છુટી
 ગયેલા રોઝા રાખીને) ગણતરી પૂરી કરે; અને તે
 લોકો કે જેઓ (રોઝા) રાખી શકે છે (અને ન રાખે
 તો) તે તેના બદલામાં એક મિસ્કીનને ખાવાનું
 ખવડાવે; પછી જે કોઈ પોતાની ખુશીથી (નેકી) કરે

તો તે તેના માટે વધુ સારું છે; પણ જો તમે સમજો
તો ગમે તે સ્થિતિમાં રોઝા રાખવા એ તમારા માટે
સારું જ છે.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ
وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَى وَالْفُرْقَانِ ۗ فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ
فَلْيَصُفِّهُ ط وَمَنْ كَانَ مَرِيضًا أَوْ عَلَى سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ
أُخْرٍ ۗ يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ
الْعُسْرَ ۚ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ
وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿١٨٥﴾

(૧૮૫) રમઝાનનો (મુબારક) મહિનો તે છે (કે) જેમાં આ કુરઆન ઉતારવામાં આવ્યું જે સઘળા મનુષ્યોનો માર્ગદર્શક છે, અને (તેમાં) સન્માર્ગની સ્પષ્ટ દલીલો તથા (સત્ય અસત્યના) નિર્ણયના (નિયમો છે,) માટે તમારામાંથી જે કોઈ આ મહિનામાં (ઘરે) હાજર હોય તો તેણે તે (મહિના)ના રોઝા રાખવાજ જોઈએ; અને જે શખ્સ માંદો (બીમાર) હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દીવસોમાં (રોઝાની) ગણતરી પૂરી કરે, અલ્લાહ તમારા સંબંધમાં આસાની ઈચ્છે છે અને સપ્તાઈ ઈચ્છતો નથી, અને તમે આ ગણતરીને પૂરી કરી નાખો એમ ઈચ્છે છે, અને જે સન્માર્ગ

તમને દેખાડી દીધો છે તે માટે અલ્લાહની મોટાઈ વર્ણવતા રહો, અને શુક્રગુઝાર બનો.

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ
إِذَا دَعَانِ ۗ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ
يَرْشُدُونَ ﴿١٢٤﴾

(૧૮૬) અને જો મારો (કોઈ) બંદો તને મારા વિશે પુછે (કે હું ક્યાં છું?) તો (કહે કે) ખચીતજ હું (તેની) પાસે જ છું, આજીજીથી પોકારનારાઓ (દોઆ કરનારાઓ) જ્યારે પણ મને પોકારે છે ત્યારે હું (તરતજ) તેમને જવાબ આપું છું માટે તે લોકોને જોઈએ કે (તેઓ પણ) મારી આજ્ઞાઓ માને તથા

મારા પર ઈમાન લાવે કે જેથી તેઓ સન્માર્ગને
પામે.

أَجَلٌ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفْتُ إِلَى نِسَائِكُمْ ط هُنَّ لِبَاسٌ
لَكُمْ وَأَنْتُمْ لِبَاسٌ لَهُنَّ ط عَلِمَ اللَّهُ أَنَّكُمْ كُنْتُمْ تَخْتَانُونَ
أَنْفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنْكُمْ ء فَالَّذِينَ بَشِرُوا هُنَّ
وَأَبْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ء وَكُلُوا وَاشْرَبُوا حَتَّى يَتَبَيَّنَ
لَكُمْ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ء ثُمَّ
أَتَمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ء وَلَا تَبَشِّرُوا هُنَّ وَأَنْتُمْ عَكْفُونَ ء
فِي الْمَسْجِدِ ط تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرُبُوهَا ط كَذَلِكَ يُبَيِّنُ
اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ ﴿١٨٤﴾

(૧૮૭) રોઝાના દિવસોમાં રાત્રિના સમયે તમારી સ્ત્રીઓ પાસે જવું તમારા માટે જાઈઝ ઠરાવવામાં આવ્યું છે, તે (સ્ત્રી) ઓ તમારી શોભા છે અને તમે તેમની શોભા છો; (આ સબંધી) તમે પોતાને છેતરતા હતા, તે અલ્લાહ જાણતો હતો જેથી તે તમારા પ્રત્યે માયાળુપણું દાખવ્યું, અને તમને દરગુજર કર્યા, માટે હવે તમે તેમની સાથે સમાગમ કરો, અને અલ્લાહે તમારા માટે જે (ઓલાદ) નિમાર્ણ કરી છે તેની ઈચ્છા કરો, અને ખાઓ પીવો ત્યાં સુધી કે સવારનું અજવાળું (રાત્રિના) અંધકારથી જુદું દેખાઈ આવે, પછી રાત્રિના આરંભમાં રોઝો પુરો કરો, અને જ્યારે

મસ્જિદોમાં બંદગીની હાલતમાં (એઅતેકાફ) હો ત્યારે તેમને (સ્ત્રીઓને) રાત્રે પણ સ્પર્શ કરો નહિ; આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, માટે તેનું ઉલ્લંઘન કરશો નહિ; આવી રીતે અલ્લાહ પોતાના હુકમો લોકો માટે સ્પષ્ટ કરી વર્ણવે છે કે જેથી તેઓ ગુનાહોથી બચે.

وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ
لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنْتُمْ تَعْلَمُونَ ﴿١٤٤﴾

(૧૮૮) અને માંહોમાંહે એક બીજાનો માલ અયોગ્ય રીતે ખાઈ ન જાઓ તેમજ તેને લગતા કજીયા હાકેમો પાસે એ માટે ન લઈ જાઓ કે નાહક જાણી

જોઈને લોકોના માલ(માં)થી જે કંઈ (હાથ લાગે)
તમો (તે) ખાઈ જાઓ.

يَسْأَلُونَكَ عَنِ الْآهْلِ ط قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ط
وَلَيْسَ الْبِرُّ بِأَنْ تَأْتُوا الْبُيُوتَ مِنْ ظُهُورِهَا وَلَكِنَّ الْبِرَّ مَنْ
اتَّقَى ؕ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ؕ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ
تُفْلِحُونَ ﴿١٦٨﴾

(૧૮૯) લોકો તને પહેલી રાતના ચાંદ માટે પૂછે
છે; કહે કે તે લોકો (ના ફાયદા) માટે તથા હજના
માટે નક્કી કરેલા વખતો (દેખાડનાર નિશાનીઓ)
છે; અને તમે મકાનોમાં તેની પાછળ (ના ભાગે)થી
(એહરામની હાલતમાં) દાખલ થાઓ એ સદગુણ

નથી પણ સદગુણ તો એ છે કે ગુનાહોથી બચીને ચાલવું, અને મકાનોમાં તેમના દરવાજાઓમાંથી દાખલ થાઓ અને અલ્લાહથી ડરતા રહો જેથી તમે સફળતા પામો.

وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا إِنَّ
اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ﴿١٩٠﴾

(૧૯૦) અને અલ્લાહના માર્ગમાં તે લોકો સાથે લડો કે જેઓ તમારી સાથે લડે પણ (તેમાં) હદ બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી.

